

**October 18, 2024**

To, <b>Bombay Stock Exchange Limited</b> 1 <sup>st</sup> Floor, New Trading Ring, Rotunda Building, P. J. Tower, Dalal Street, Mumbai – 400 001.  <b>Scrip Code: 533275</b>	To, <b>National Stock Exchange of India Ltd.,</b> Exchange Plaza, C-1, Block G, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 051  Company Symbol: <b>SHAH</b>
--	---

**SUB. :Submission of copy of Newspaper Publication for Financial Results for the quarter and half year ended September 30, 2024.**

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copy of Newspaper cuttings of the Unaudited Financial Results of the Company for the quarter and half year ended September 30, 2024, as approved by the Board of Directors in their Meeting held on October 16, 2024, and published in Business Standard Newspaper (English edition) & Jai Hind (Gujarati edition) on October 18, 2024.

Submitted for your kind information and necessary records.

Thanking you.

Yours faithfully,

**For Shah Metacorp Limited  
(Formerly known as Gyscoal Alloys Limited),**

**Mona Shah**  
**Director**  
**(DIN: 02343194)**

**Encl: As above**

VIVID MERCANTILE LIMITED							
CIN: L74110GJ1994PLC021483							
Registered Office: Basement Medicare Centre, B.H. M.J. Library, Opp. Stock Exchange, Ellisbridge, Ahmedabad - 380006, Gujarat.   Website: www.vividmercantile.com   Email: info@vividmercantile.com   Telephone: 9824050699							
EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2024 (Rs. in Lakhs)							
Sr. No.	Particulars	Quarter ended on 30-09-2024 Unaudited	Quarter ended on 30-06-2024 Unaudited	Quarter ended on 30-09-2023 Unaudited	Half Year ended on 30-09-2024 Unaudited	Half Year ended on 30-09-2023 Unaudited	Year ended on 31-03-2024 Audited
1	Total Income	8.60	97.44	584.65	983.04	887.11	2832.76
2	Net Profit for the year before tax	24.99	50.35	45.9	75.34	236.02	1493.74
3	Net Profit for the year after tax	24.99	40.35	40.9	65.34	191.48	1297.79
4	Total Comprehensive Income for the year	242.2	15.3	40.9	257.5	2279.76	2279.76
5	Paid up Equity Share Capital	1002.56	1002.56	1002.56	1002.56	1002.56	1002.56
6	Other Equity Excluding Revaluation Reserve Earnings per Share (Face Value of Rs. 10/- each) Basic & Diluted	2.42	0.40	0.41	2.57	1.91	12.94

Notes: (a) The above financial result was reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 16.10.2024 (b) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on September 30th, 2024 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. (c) The above is an extract of the detailed format of Quarterly Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (d) The figures for the previous quarters / periods are re-arranged/re-grouped, wherever considered necessary. For and on behalf of Vivid Mercantile Limited Place: Ahmedabad | Date: 16/10/2024 | Sd/- Satishkumar Ramanlal Gajjar, Managing Director - DIN: 05254111

SHAH METACORP LIMITED (FORMERLY KNOWN AS GYSICAL ALLOYS LIMITED)							
Regd. Office: Plot No. 2/3 GIDC, Ubhkhil, Kankarwada, Taluka: Vijapur, Dist.: Mehsana - 382830, Gujarat.   Website: www.gysical.com   Email: info@gysical.com   Telephone: 079-26574878   CIN: L2709GJ1999PP0303656							
STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30.09.2024 (Rs. in Lacs, Except EPS)							
Sr. No.	Particulars	Quarter Ended on 30-09-2024 (Unaudited)	Quarter Ended on 30-06-2024 (Unaudited)	Quarter Ended on 30-09-2023 (Unaudited)	Half Year Ended on 30-09-2024 (Unaudited)	Half Year Ended on 30-09-2023 (Unaudited)	Year End 31-03-2024 (Audited)
1	Total Income From Operation	4,854.33	4,628.98	2,133.25	9,483.31	3,757.71	9,676.54
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	248.71	263.76	76.39	512.47	204.41	440.48
3	Net Profit / (Loss) for the period before Tax (after exceptional items)	248.71	274.96	76.39	299.67	204.41	440.48
4	Net Profit for the period after tax (after Exceptional Items)	246.55	233.61	75.94	258.66	201.22	426.32
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	246.55	233.61	75.94	258.66	201.22	433.42
6	Paid up Equity Share Capital (Face Value of Rs.1/- each)	5,848.79	4,193.39	1,582.76	5,848.79	1,582.76	1,167.98
7	Earnings per Share - Not Annualised (in Rs.)	0.05	0.56	0.05	0.54	0.13	0.37
8	Diluted	0.05	0.56	0.05	0.54	0.13	0.37

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPT, 2024

Sr. No.	Particulars	Quarter Ended on 30-09-2024 (Unaudited)	Quarter Ended on 30-06-2024 (Unaudited)	Quarter Ended on 30-09-2023 (Unaudited)	Half Year Ended on 30-09-2024 (Unaudited)	Half Year Ended on 30-09-2023 (Unaudited)	Year End 31-03-2024 (Audited)
1	Total Income From Operations	4,854.33	4,488.39	2,133.25	9,342.72	3,757.71	9,187.22
2	Net Profit / (Loss) before tax	250.65	257.29	76.39	507.92	204.41	434.75
3	Net Profit / (Loss) after tax	248.49	2,327.34	75.94	257.82	201.22	420.59
4	Total Comprehensive Income	248.49	2,327.34	75.94	257.82	201.22	427.69

Notes: (1) The principal business of the Company is manufacturing and sale of S.S. Products. (2) Net Profit for the above Financial Results have been reviewed and considered by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on 16.10.2024. (3) These Unaudited Consolidated Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards ("Ind-AS") as specified under section 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended from time to time) and the provisions of the Companies Act, 2013 and other recognized accounting practice and policies to the extent applicable. (4) The above is an extract of detailed format of Standalone financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirement) Regulation, 2015. The full format of Standalone and Consolidated financial results are available on the Company's website www.gysicalalloys.com and on the website of the BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com. (5) The consolidated financial results of the associate company viz. Goldman Hotels & Resorts Private Limited and wholly owned subsidiary company viz. Shah Agropac Private Limited. (6) The figures for the corresponding previous period have been regrouped/reclassified wherever necessary, to make them comparable. (7) The Company has paid Rs.2190.00 Lakhs in total to M/s. Omkara Asset Reconstruction Private Limited towards entire settlement amount. The company has made payment of Rs.1900.00 Lakhs till March, 2024 and Rs. 290.00 Lakhs in April, 2024 and received no due certificate as on 30.09.2024. (8) The respective Investor complaints received and resolved during the quarter and the Complaints left unattended as on 30.09.2024 in Nil. (9) The company has issued and allotted 2,25,40,000 Equity Shares of face value of Rs. 1/- to Promoters on preferential basis in violation of warrants issued on 28.07.2023 at an issue price of Rs. 3.24/- each (including premium of Rs. 2.24/- per Equity Share). (10) The company has issued and allotted 4,45,00,000 convertible warrants into Equity Shares within a period of 18 months from the date of allotment of warrants, carrying value of Rs. 1/- to M/s. Mona Shah, Promoters, on preferential basis at an issue price of Rs. 0.02/- each (including premium of Rs. 3.02/- per Equity Share) (2850746 convertible warrant issued pursuant to conversion of loan of Rs. 120000000 and remaining 14649254 convertible warrant issued against cash. (11) The company has issued and allotted 1,30,00,000 Equity Shares of face value of Rs. 1/- to Non-Promoters on preferential basis at an issue price of Rs. 0.02/- each (including premium of Rs. 3.02/- per Equity Share) to Non-Promoters. Place: Ahmedabad | Date: 16/10/2024 | For and on behalf of Shah Metacorp Limited (formerly known as Gysical Alloys Limited) Sd/-: Mona Shah, Director and Chairperson

**POSSESSION NOTICE**

Whereas, Union Bank of India under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) ("said Act") and in exercise of powers conferred under Section 13 (12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 ("said Rules") issued a demand notice dated August 25, 2011, calling upon the borrower viz. M/s. Vama Exports Ltd and all the guarantor(s) and mortgagor(s) being M/s. Recoll Developers Pvt. Ltd., M/s. Boganville Farm Pvt. Ltd., M/s. Vadgas Realty Pvt. Ltd., M/s. Vasudha Farm Pvt. Ltd. and M/s. Karnavati Enterprises to repay the amount/details of which are mentioned in the table below:

And whereas subsequently, Union Bank of India has vide Assignment Agreement dated March 30, 2013 assigned all its rights, title, interest and benefits in respect of the debts due and payable by the borrower/guarantor(s)/mortgagor(s) arising out of the facilities advanced by Union Bank of India to borrower/ guarantor(s) alongwith the underlying Immovable Property to Asset Reconstruction Company (India) Limited acting in its capacity as Trustee of Arcil - Vama Exports Ltd Trust ("Arcil") for the benefit of the holders of Security Receipts. Therefore, in view of the said assignment, Arcil now stands substituted in the place of Union Bank of India and Arcil shall be entitled to institute/continue all and any proceedings against the borrower/ guarantor(s)/mortgagor(s) and to enforce the rights and benefits under the financial documents including the enforcement of guarantee and security interest executed and created by the borrower/guarantor(s)/mortgagor(s) for the financial facilities availed by them.

The borrower/guarantor(s)/mortgagor(s) having failed to repay the said amounts, notice is hereby given to the borrower/guarantor(s)/mortgagor(s) in particular and the public in general that the undersigned being the Authorized Officer of Arcil has taken possession of the underlying Immovable Property described herein below in exercise of powers conferred on him/her under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the said Rules on "AS IS WHERE IS & WHATEVER THERE IS BASIS" on the date mentioned below.

Borrower Name and Guarantors	Demand Notice	Possession Date
<b>Borrower: M/s. Vama Exports Ltd</b> Registered Office: Amratil Tribhovanand Dashapourwad Society, Paldi, Ahmedabad, Gujarat, India - 380007 <b>Guarantors:</b> 1. M/s Boganville Farms Pvt Ltd 2. M/s Vasudha Farms Pvt Ltd 3. M/s Vadgas Realty Pvt Ltd	Rs.21,31,32,888.70/- Rupees Twenty One Crore Thirty One Lakhs Thirty Two Thousand Eight Hundred and Eighty Eight and Paise Seventy only/ as August 24, 2011 along with future interest at the contractual rate on the aforesaid amount with effect from August 25, 2011 together with incidental expenses, cost, charges etc. Notice dated: 25.08.2011	13.10.2024

**Description of Property**

1. Property owned by M/s Boganville Farms Pvt Ltd  
All that piece and parcel of non-agricultural lands at Survey Nos. 40, 43, 46, 47, 48, 49, 51, 52, 53, 54, 56, 57, 59, 63, 64, 65, 66, Mouje Village Vadgas, Taluka Viramgam, Sub-District, Viramgam and District Ahmedabad, more particularly described as

Survey No.	Area (in Sq. mtrs.)	Bounded By
40	6475	East: Border of Thori Vadgas; West: Plot of S No 39 & 25, North: Border of Thori Vadgas; South: Plot of S No 41, 42 & 43
43	5406	East: Small Road & Border of Kakarawai; West: Plot of S No 42; North: Border of Thori Vadgas & Plot of S No 40; South: Plot of S No 44
46	7386	East: Plot of S No 44; West: Plot of S No 50 & 51; North: Plot of S No 39 & 45; South: Plot of S No 47
47	4957	East: Plot of S No 44; West: Plot of S No 50; North: Plot of S No 46 & 44; South: Plot of S No 48
48	4350	East: Plot of S No 44; West: Plot of S No 50; North: Plot of S No 47; South: Plot of S No 49
49	12444	East: Small Road; West: Plot of S No 50 & 60; North: Plot of S No 48; South: Plot of S No 61
51	1821	East: Plot of S No 46; West: Plot of S No 52 & 53; North: Plot of S No 39; South: Plot of S No 50
52	4047	East: Plot of S No 51; West: Plot of S No 36; North: Plot of S No 39; South: Plot of S No 53
53	4249	East: Plot of S No 50 & 51; West: Plot of S No 36; North: Plot of S No 52; South: Plot of S No 54
54	7082	East: Plot of S No 50; West: Plot of S No 36; North: Plot of S No 53; South: Plot of S No 56
56	7183	East: Plot of S No 50; West: Plot of S No 36; North: Plot of S No 54; South: Plot of S No 57
57	8600	East: Plot of S No 50; West: Plot of S No 36; North: Plot of S No 56; South: Plot of S No 60 & 58
59	11028	East: Plot of S No 62; West: Plot of S No 36; North: Plot of S No 58 & 60; South: Small Road
63	5868	East: Plot of S No 64; West: Plot of S No 62; North: Plot of S No 61; South: Small Road
64	2630	East: Plot of S No 64; West: Plot of S No 63; North: Plot of S No 61; South: Small Road
65	2630	East: Plot of S No 66; West: Plot of S No 64; North: Plot of S No 61; South: Small Road
66	6070	East: Small Road; West: Plot of S No 65; North: Plot of S No 61; South: Small Road
TOTAL	102226	

2. Property owned by M/s Vasudha Farms Pvt Ltd  
All that piece and parcel of non-agricultural lands Survey Nos. 189 & 190, Mouje Kankravadi, Taluka Viramgam, Sub-District Viramgam, District Ahmedabad, more particularly described as under:

Survey No.	Area (in Sq. mtrs.)	Bounded By
189	6715	East: Land of Survey No 217/A; West: Land of Survey No 190; North: Road; South: Road
190	22822	East: Land of Survey No 189; West: Road; North: Road; South: Road
TOTAL	29537	

3. Property owned by M/s Vadgas Realty Pvt Ltd  
All that piece and parcel of non-agricultural lands Survey Nos. 208, 209 & 211, Mouje Kankravadi, Taluka Viramgam, Sub-District Viramgam, District Ahmedabad, more particularly described as under:

Survey No.	Area (in Sq. mtrs.)	Bounded By
208	65155	East: Land of Survey No 209; West: Land of Survey No 207; North: Land of Survey No 207 & 209; South: Road
209	55139	East: Land of Survey No 209 Paiki Agricultural; West: Land of Survey No 208; North: Land of Survey No 209 Paiki Agricultural; South: Land of Survey No 211
211	35724	East: Border of village Veni; West: Small Road; North: Land of Survey No 209; South: National Highway
TOTAL	156018	

Hereinafter referred to as "Immovable Properties"

The borrower/guarantor(s)/mortgagor(s) in particular and the public in general are hereby cautioned that Arcil in the lawful possession of the Immovable Property mentioned above and under Section 13(13) of the SARFAESI Act, 2002, the borrower/guarantor(s)/ mortgagor(s) or any person whatsoever, shall after receipt of this notice not transfer by way of sale, lease or otherwise deal with/ alienate the Immovable Property, without prior written consent of Arcil and any dealings with the Immovable Property will be subject to the charge of Arcil for the amount as mentioned above along with future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges etc.

The borrowers/guarantors/mortgagors' attention is invited to the provisions of the Sub-Section (8) of Section 13 of the said Act, in respect of time available to redeem the above mentioned Immovable Property.

Sd/- Authorised Officer  
Place: Viramgam, Ahmedabad  
Date: 13.10.2024  
Asset Reconstruction Company (India) Ltd.  
Trustee of Arcil - Vama Exports Ltd Trust

**Arcil**  
Premier ARC  
CIN: U65999MH2002PLC134884, Website: www.arcil.co.in  
Registered Office: The Ruby, 10th Floor, 29 Senapati Bapat Marg, Dadar (West), Mumbai - 400 0028  
Tel.: 022-6658130  
Branch Address: 610, 6th Floor, Sun Square, Near Hotel Regenta Central Antrim, Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380 006, Gujarat. Tel: 079 - 40306301 / 02

**PUBLIC NOTICE** I, Sunilkumar R. Jain (Advocate) under the instruction and direction of my client Mr. Hareeshbhai Natvarbhai Patel, hereby giving this public notice that the Residential Tenement No. 4 bearing City Survey No. 0010021 having Plot area measuring around 132.89 sq. mtrs along with construction admeasuring 58.77 sq. mtrs standing thereon, of the scheme known as "BHAVESH TENEMENT" and society known as "NATRAJ SOCIETY - 2", situated on the land of Final Plot No. 7/2 paiki, TPS No. 96/A of mouje/village - Hansol, Taluka - Asarva and Dist. Ahmedabad, owned and possessed by Hareeshbhai Natvarbhai Patel. Now, said Hareeshbhai Natvarbhai Patel asked us to issue title clearance certificate for Tenement No. 4 bearing City Survey No. 0010021, located at society known as "BHAVESH TENEMENT" and society known as "NATRAJ SOCIETY - 2", situated on the land of Final Plot No. 7/2 paiki, TPS No. 96/A of mouje/village : Hansol, Taluka : Asarva and Dist. Ahmedabad. Hence, we hereby with present public notice inform public and to all concerned that if any individual, bank, government/semi government offices have any objection, right, claim, interest, title, relation, encumbrance, maintenance with regards to said Tenement No. 4 then such objection should be raised with appropriate written documents/ evidence within 7 days from the date of publication of this notice. Please take a note that if no objections are received by us within 7 days from the date of publication of this notice, then title clearance certificate qua said property i.e. Tenement No. 4 will be issued. Place : Ahmedabad Date : 16/10/2024 Through Me, Sunilkumar R. Jain, (Advocate) L Exp Art Associates, Office No. B/133, Sumel-7, Nr. SoniChawl, Odhav, Ahmedabad. M.: 9825900946

**पावरग्रिड POWERGRID**

**NOTICE**

1. Petition for determination of tariff under Section 62 read with Section 79 (1) (d) of Electricity Act, 2003 and under the Regulation 15 (1) (a) and Regulation 23 of Central Electricity Regulatory Commission (Conduct of Business) Regulations, 2003 read with Central Electricity Regulatory Commission (Terms and Condition of Tariff Regulations) 2024 for Petition-1: Scheme to control fault level at Wardha Substation in Western Region, Petition-2: POWERGRID works associated with the new WR-NR 765 kV inter regional corridor.

2. The beneficiaries of the above-mentioned Transmission system are: (1) Madhya Pradesh Power Management Company Ltd, Jabalpur (2) Chhattisgarh State Power Distribution Company Limited, Raipur (3) Gujarat Urja Vikas Nigam Ltd., Vadodara, (4) Electricity Department, Government of Goa, Panaji, (5) Maharashtra State Electricity Distribution Company Ltd., Mumbai, (6) DNHD Power Distribution Corporation Limited, Silvassa.

3. Tariff details:

a) 2019-24 Block

Petition no	Asset detail	DOC/ ECOD	Completion Cost as on 31.03.2024	2019-20	2020-21	2021-22	2022-23	2023-24
Petition-1	Asset-1	25.11.2022	4908.17	-	-	-	276.13	856.91
Petition-2	Asset-1	01.08.2021	19427.55	-	-	1836.86	2941.07	3100.94

b) 2024-29 Block

Petition no	Asset detail	Completion Cost as on 31.03.2029	2024-25	2025-26	2026-27	2027-28	2028-29
Petition-1	Asset-1	5545.18	AFC 900.97	933.31	917.31	902.73	882.30
Petition-2	Asset-1	19471.11	AFC 3299.09	3254.45	3210.50	3145.22	3075.97

4. A copy this notice and of the application made for determination of tariff is posted on the website of the applicant at [www.powergrid.in](http://www.powergrid.in).

5. The suggestions and objections, if any, on the proposals for determination of tariff contained in the petition may be filed by any person, including the beneficiaries through the e-filing portal of the Commission or in writing before the Secretary, Central Electricity Regulatory Commission, 6th & 8th floor, Tower B, World Trade Centre, Naroji Nagar, New Delhi - 110029 (or other address where the office of the Commission is situated), with a copy to the petitioner at the address of its corporate office within 30 days of publication of this notice.

Date: 17/10/2024  
Place: Gurugram  
Sd/- GM (Commercial)

**POWER GRID CORPORATION OF INDIA LIMITED**  
(A Government of India Enterprise)  
Corp. Off.: Saudamini, Plot No.-2, Sector-29, Gurgaon, Haryana-122001  
Regd. Off.: B-9, Qutab Institutional Area, Katwaria Sarai, New Delhi-110016  
Website: [www.powergrid.in](http://www.powergrid.in), CIN: L40101DL1999GO038121  
A Maharatna PSU

**सेंट्रल बैंक ऑफ इंडिया**  
**सेंट्रल बैंक ऑफ इंडिया**  
**Central Bank of India**  
CENTRAL TO YOU SINCE 1911

**BRANCH: KARELIBAUG**

**APPENDIX - IV [See rule - 8(1)]**

**POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)**

Whereas, the Authorised officer of the Central Bank of India, Karelibaug Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13 (2) and 13 (12) read with the Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a demand notice dated 09.05.24 calling up on the borrower Sri Ramanbhai Ranchohbhai Gholl and Shri Vijay Kumar Ramanbhai Gholl, to repay the amount mentioned in the notice being Rs. 10,74,522.86/- (Rupees Ten lakhs Seventy four thousand five hundred and twenty two and paise eighty six only) (which represents the principal plus interest due on the 09.05.2024 plus interest and other charges from 09.05.2024 to till date within 60 days from the date of the receipt of the said notice.

The Borrower having failed to pay the entire dues of the bank, notice is hereby given to the borrower, the co-borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13 (4) of the said act, read with Rule 8 of the Security Interest (Enforcement) Rule 2002 on this 16.10.2024.

The borrower and the co-borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to charge of Central Bank of India, for the amount of Rs. 10,74,522.86/- (Rupees Ten lakhs Seventy four thousand five hundred and twenty two and paise eighty six only) (which represents the principal plus interest due on the 09.05.2024), plus interest and other charges from 09.05.2024.

The borrowers attention is invited to provisions of sub section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

Complete detailed description of Immovable property Land & Building and details of title deed with its boundaries. Duplex No.-11, Sai Residence, land bearing R.S.No.195, New R.S.No. 257, admeasuring 6374 sq. mtr. Situated in the sim of Moje-Asodar, Taluka-Anklav, District-Anand having plot admeasuring 736 sq. feet and 535.20 sq. feet of undivided common road and common area which totalling plot area is 1271.20 sq. feet, along with construction area is 1150sq. Feet. Boundaries: East- Society Road, West- Duplex No. 14, North- Duplex No. 12, South- Duplex No. 10.

Date: 18.10.2024- Place: Baroda  
Authorised Officer, Central Bank Of India

**PAUSHAK LIMITED**  
CIN: L51909GJ1972PLC044638  
Regd. Office: Alembic Road, Vadodara - 390 003  
Website: [www.paushak.com](http://www.paushak.com) | Email: [investors@paushak.com](mailto:investors@paushak.com)  
Tel: +91 265 6637000

**NOTICE OF LOSS OF SHARES CERTIFICATE(S)**

Notice is hereby given that the following Equity Shares Certificate(s) of the Company have been reported as lost/ misplaced and the registered Equity Shareholder(s) (Legal Heirs) have applied to the Company for the issue of duplicate Equity Shares Certificate(s).

Shareholder's Name and/or Claimant's (Legal Heirs) Name	Folio No. (s)	Certificate No. (s)	Distinctive Nos.	No. of Shares
Savitri Bai Narayan Bhat Shivapura (Deceased) wife of Narayanbhat Puttanabhat Shivapur (Deceased) the Claimants are 21 Legal Heirs as under:	S00697	2488	1018646-1019445	800

1. Anant Narayanbhat Shivapur, 2. Leelavati Haridas Bhat Shivapur, 3. Sudheendra Haridasbhat Shivapur, 4. Ravindra Haridasbhat Shivapur, 5. Nagarathna Vishnumurthi Shivapur, 6. Vinay Vishnumurthi Shivapur, 7. Shipa Vishnumurthi Shivapur, 8. Ramadevi Raghvendraharbhat Shivapur, 9. Radhika Rao, 10. Jayashri Shivapur, 11. Subhashithi Raghavendra Bhai Shivapur, 12. Makkimane Ganeshiah Uma, 13. Mukund Prasad V Shivapur, 14. Shobha Ramesh Shivapur, 15. Reshma Niranjan Gadag, 16. Rakhesh Ramesh Shivapur, 17. Saraswati J Bhat, 18. Krishnamurthy Narayanbhat Shivapur, 19. Nagarajbhat Narayanbhat Shivapur, 20. Vidya Nyaldi, 21. Kithandur Ramakrishna Jyothi.

The Public is hereby warned against purchasing or dealing with these securities in any way. Any person(s) having any claim in respect of the aforesaid Equity Shares Certificate(s), should immediately send full details with documentary evidence to the Company's RTA - Link Intime India Private Limited at its office at "Geetanjali", 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara - 390015 or to the Company at its Registered Office mentioned above, so as to reach us within 15 days from the date of publication of this Notice, failing which, the Company will proceed to issue duplicate Equity Shares Certificate(s) without further information.

Please note that no claims will be entertained by the Company or the RTA with respect to original Equity Shares Certificate(s) subsequent to the issue of duplicate thereof.

For Paushak Limited  
Sd/- Sagar Gandhi  
Company Secretary  
Date : 17<sup>th</sup> October, 2024  
Place : Vadodara

This Notice shall also be available at Investor Section of the Company's website [www.paushak.com](http://www.paushak.com) and Corporate Announcement Section of Stock Exchange's website [www.bseindia.com](http://www.bseindia.com)

**Chola**  
Enter a better life

**CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED**  
Corporate Office: "Chola Crest" C-54 & 55, Super B-4, Thiru vi ka industrial estate, guindy, Chennai - 600 032  
Branch Office: 408 to 410, 4th Floor, "The One World" Cos. Synergy Complex, Near Anna Park, 151 Feet Ring Road, Rajaj - 500035  
Contact No: Nitin Panchal-9825438897 / Prenal Bhatt - 9376152988 / Prishaz Oza - 9824558664

**SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**

E-auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower / Co-Borrower / Mortgagor (s) that the below described immovable properties mortgaged to the Secured Creditor, the SYMBOLIC POSSESSION of which has been taken by the Authorised Officer of Cholamandalam Investment and Finance Company Limited the same shall be referred herein after as Cholamandalam investment and Finance Company Limited. The Secured Assets will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis through E-A

